https://archive.org/details/bk1049/page/n0/mode/1up
-Mathal Sanatani Sabha Minutes (1049)
All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

॥ ૐ ॥ ૩૯ KJ-BK-3-29

સં. ૨૦૦૨ના ફાગણ વદ ૧૧ ને ગુરૂવાર ના રોજ ગામ શ્રી મથળ મધ્યે
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ની ૧ જાહેર સભા. ગામ શ્રી મથળના
... ભાઈઓ મળેલ હતા જેમાં નીચે મુજબ ગામના ભાઈઓ એ હાજરી આપી
હતી ૧ મથળ - ૨ કોટડા જડોદર ૫૦ - ૩ નખત્રાણા ૨ - ૪ ... ૨ - ૫ દેશલપુર ૮ - ૬ ખોંભડી ૫
૭ ઉખેડા ૧૫ ૮ વિરાણી ૧૫ - ૯ રોહા ૧૭ વગેરે ગામના ભાઈઓ એ હાજરી આપી
હતી ને સભામાં લગભગ ૬૦૦ ના ભાઈઓ બહેનો એ હાજરી આપી હતી ને
તે સભામાં કાર્યક્રમ નીચે મુજબ.

૧ ઈશ્વર ના પ્રાર્થના વાજીંત્ર સહીત.
૨ બાળકો ના પ્રાર્થના " "
૩ આ સભાનો ઉદેશ. ભાઈ પ્રમુખ ના દરખાસ્ત રજુ કરનાર, પા. નથુ નાનજી
૪ તેને ટેકો આપનાર શ્રી માન પા. પરબત લધુ તથા પા. વિશ્રામ ભાઈ નાગજી નથુ
૫ પ્રમુખ તરીકે પટેલ ધનજી ખીમજી - ને તેમના ... (સનાતની શાંતિ
... પ્રમુખ તરીકે ... આપણા ભાઈઓ ... આપ્યું છે તે માટે ...
હું ... વગેરે વગેરે)
૬ સાધુ દયાળદાસજી શ્રી ગુરૂ ...
સનાતન ભાઈઓ સર્વે આપણા કચ્છના પાટીદાર ભાઈઓ માં
સનાતન ધર્મ નું પાન ... ... ધર્મ ... રહ્યા છે
માટે એવા જે આપણો ... છીએ આપણું કરતવ્ય શું - આપણે
... ઉપર ... શાસ્ત્ર ... કોઈનું માનવું ...
સાધુ દયાળદાસ ... તરફ ... માટે ... છે તે
... પાટીદાર શાંતિ ... વગેરે ...
... છે છતાં સાધુ તરીકે ... ફરજ ... કરવા ...
... વગર ... ધર્મ ... છે - હું ...
... ને ધર્મ ... કરવા છે ...
... તે ...
ધર્મના વિષય ઉપર આપણા ભાઈ મુળશંકર ભાઈ એ સમજાવ્યું આ સાન
ધી સાભળ્યું તે માટે વિસેસમાં ભાઈ રતનશી ભાઈએ સમજાવ્યું કે હું મારા સ્વાર
થ માટે નહિ પણ આપ સૌના ... ધર્મમાંથી છોડાવવા
મારો ઉદેશ છે તેમજ હું સાધુ નું ધર્મ શાસ્ત્ર ને ઉપદેશ દૈશું.
૭ ડેપ્રા ભાઈ ... ગામ ... નુ વિવેચન.
મારા વ્હાલા સાન ... આપ સહુ સભામાં પધારી આ
... તે ... આપ ... ભાઈઓ નો આ
ભાર માનું છું આપ ... નાના ... એવું ...
... કરતા રહશો વિશેષમાં ભાઈ રતનશી ... ભાઈ
આ પ્રમાણે ... કરો છો ...

https://archive.org/details/bk1049/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 2, 3, 4, 5, 6.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1049/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 16:30:52 +05'30'

VSA: 06-Sep-1945
Date recorded as per Kutchhi Calendar in which new year starts with Ashadh month

realpatidar.com

॥ શ્રી ૐ ॥ ૩૧ KJ-BK-329

સં. ૨૦૦૨ના શ્રાવણ વદ ૧૧ ને ગુરૂવાર ના રોજ ગામ શ્રી મથલ સ્થાને
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ની ૧ જાહેર સભા. ગામ શ્રી મથલના
~~ચોક~~ ચોકમાં મળેલ હતી જેમાં નીચે મુજબ ગામના ભાઈઓ એ હાજરી આપી
હતી. ૧ શ્રી મથલ - ૨ કોટડાજડોદર ૫૦ - ૩ નખત્રાણા ૨ - ૪ ખીરસરા ૨ - ૫ દેશલપુર ૮ - ૬ ઝીંઝાય ૫
૭ ઉખેડા ૧૫, ૮ વિરાણી ૧૫ - ૯ રોડાસર ૧૭ વગેરે ગામના ભાઈઓ એ હાજરી આપી
હતી. ને સભામાં લગભગ ૬૦૦ ના ભાઈઓ તથા બહેનો એ હાજરી આપી હતી. ને
તે સભામાં થયેલ કાર્ય ક્રમની નોંધ નીચે મુજબ.

૧ ઈશ્વર ની પ્રાર્થના - બાળકો સહીત.
૨ બાળકો ની પ્રાર્થના " "
૩ આ સભાનો ઉદ્દેશ. તથા પ્રમુખની દરખાસ્ત રજુ કરનાર, પ. નથુ નારણ
૪ તેને ટેકો આપનાર શ્રી માવ પ. કરમશી - તથા પ. ખીમજી ભાઈ નારાણ (નાથા)
૫ પ્રમુખ તરીકે પટેલ ધનજી ખીમજી - ને તેમના જે ભાષણ (સનાતની સંભળાશે
આ જે પ્રમુખ તરીકે જે આપ ભાઈઓએ માન આપ્યું છે તે માટે આપનો
હું ઋણી છું. વગેરે વગેરે)
૬ સાધુ દયાળદાસજી શ્રી ગુરુ સત્યદેવદાસજી
સનાતની ભાઈઓ સભ્યો. આપણા કચ્છના પાટીદાર ભાઈઓ માં
સનાતન ધર્મ નું પાન ઘટવાથી ભાઈ ભાઈ પીરાણા ધર્મ માની રહ્યા છે
માટે એમ જો આપણે કાંઈ કરીએ આપણું કર્તવ્ય શું - આપણે
એકજ બનીએ ઉપર આવેલ જે શુભ માર્ગે ચડીએ કોઈનું માનવું હશે
સાધુ દયાળદાસ. બાજ બાપા. તરફ કુપંથ. પાછા મોર. રાખવા ઉપર છે. તો
સનાતની પાટીદાર સંઘ રચાય. બાજ કડવા. વગેરે કોમોમાં આવે
ગણુ બાજ છે. છતાં સાધુ. તરફ ના આભારી ફરજ પર કરવા. હાથે આ
કોમ પાખંડ. ઉથાપન વગર તેડશે. - ધર્મ પાલન બધીજ મહત્વ છે. - હું ગણત
વાત આપીશુ. ને ધર્મ પાછા પાવન કરવા છે. ને બધ વાત. પાનશ્રવણ
કરે. તે બોધ. ઉપદેશ -
ધર્મના વિષય ઉપર આપણા ભાઈ મુળશંકર ભાણજી એ સમજાવ્યું અને સાન
થી સાંભળ્યું તે માટે વિશેષ માં ભાઈ રતનશી એ (ભાઈએ) સમજાવ્યું કે હું મારા વિચાર
થી માર નાર પણ આપ સૌના પાખંડી દૈવી ધર્મ માંથી છોડાવવા
મારો ઉદ્દેશ છે તેમજ હું સાધુનું ધર્મ શાસ્ત્ર ને ઉપદેશ દેઉં છું.
૭ કેશવ ભાઈ શિવદાસે ગામ મોટાના નુ વિવેચન.
મહારા વ્હાલા સનાતની બંધુઓ આપ સહુ સભામાં પધારી આ
શી સભા ને જે માન આપ્યું છે તે બદલ આપ સર્વ ભાઈઓ નો આ-
ભાર માનું છું અને આપણે સનાતની ના ઉન્નત થાય એવું કાર્ય કરવા-
શા કરતા રહશો વિશેષમાં ભાઈ રતનશી તથા બાબા. અન્ય ભાઈ
આ પ્રમાણે દેશ આગળ ફેલાવવા છો તે કાર્ય ને હું ક્રમાનુસાર

૩૨ KJ-BK-3-30

આપણા શાળા ના આગેવાનો ને આપણા ઉપર એટલે સનાતન ધર્મ ને પાળનારા ઉપર જુલમ કરતા તે હવે ટકવા નો નથી માટે જાગ્યા ત્યાંથી સવાર માની સનાતન ધર્મને જલ્દી માનતા થઈ જાવો હવે ઉગવાનો શમય નથી તેમ કોઇ ભય રાખવાની જરૂર નથી વિગેરે વિગેરે - તાળીયો -

તેવાત પટેલ. મધુ ભાઇ નાનજી એ ગામ શ્રી ગનપત ના શ્રી માન ભાઇ મુળશી ભીમજી ને હીંદુ સનાતન ધર્મ પાસે બોલવા વિનંતી કરી હતી.

૮ મુળશંકર ભાઇ ભીમજી

આર્ય સજ્જનો આપે મને જે બોલવાની તક આપી છે તેમાં મારૂ એકે નીવેદન છે કે તમારી શાળાના ચરચા હું ચરચું તે કરતાં તમો ચરચો તો સારૂ તમારી શાળામાં પીરાણા ધર્મમાં આધિક જેટુ કુરાનું હતું સનાતન ધર્મ કે એવા કોઇ વસ્તુ નથી. જો ચરચા કરી શકો છે કારણ કે સનાતન ધર્મ એકે મોટો પાસાળ ધર્મ છે જેના ઉપરમાં આકાશ જેવા આધાર હતા. મનુષ્ય માત્ર સનાતન ધર્મ થી જ ટકી રહ્યું છે સનાતન ધર્મ એકે હીંદુ પાળે છે તેમ નથી પણ મુશલમાન પણ પાળે છે તેને લગતા દાખલા આપ્યા હતા ને વાશેશમાં કહયું હતું કે ઇશ્વરને ગમે તે માર્ગથી મેળવવા વગેરે વગેરે તમારી શાળામાં ધર્મને કેટલો ખાનગી રાખ્યો છે એજ જુઠી વસ્તુ છે ખાનગી શું રહે છે એકે વ્યભીચારી બીજુ ચોરી અને અનીતી એ ખાનગી રાખ્યી છે ધર્મ તો એવો કોય વિષય નથી કે તેમને ખાનગી રાખવો જોઇએ તેના દ નામે લોકેલ એકે શ્લોક સંસ્કૃતમાં કહયું હતું

ભાઇઓ ધર્મને પ્રચાર કરી શકે ધર્મનું આપણે રક્ષણ કરસું તો ધર્મ આપણું રક્ષણ કરશે. તમારા પીરાણા ધર્મમાં અથરવેદના જુઠા દાખલાઓ છે તે અથર વેદ જુઠુ છે તે આપને પીરાણા ધર્મ ના ભાઇઓને વાંચી જરા ખાતરી કરૂં છું ભાઇઓ મુશલમાન પોતાનું ધર્મ ચુકી ગયા છે ને મુશલમાન કોઇ અવતાર નથી માનતા હતા તે લોકોમાં જે દુલદુલ ગોડા કે વાગેરે જે પાખંડો કરે છે તે પણ અશરા,ના નથી ના મત છે વિશેશમાં આપણે જણાવું છે કે અથર વેદમાં છેલ્લો અવતાર ના વિષે મત ઓછા થતા નથી ના વકીલ નથુ ભાઇ ના શ્રાપે મારો ગળો બાપા વાતવાપા થતાં તેમનો મત એ નહતો કે કલયુગના અંતમાં જાશા ઇંકરૂ અવતાર થશે તેમ તેમનું માનવું હતું કે કલયુગના અંતસુધી -

https://archive.org/details/bk1049/page/n4/mode/1up
-Mathal Sanatani Sabha Minutes (1049)

KJ-BK-3-31
realpatidar.com

ચાર લોક ભાગશે જેનાર વરસતા છે માટે આ જલ્દી અવતાર લેશે ઈશારો
નો કેમ થયો તે શામળદાસ કોઈ તૈયાર છે તે બાદ મથાળ. આ સંસ્થા
સ્થાપનાર છે તે વાશે લંબાણ પુરવક વિવેચન કર્યું હતું તે બાદ ગામ
શ્રી મથાળના શ્રીમાન પટેલ. પરબત લખું ઉભા થયા હતા.

પટેલ. પરબત લખુ નું ભાષણ

મારા વહાલા સનાતની બંધુઓ તેમ બહારથી આવેલા મહેમાનો તમને
અમારા ગામના આ જાહેર સભામાં જે રાજી આપ છે તેનો હું
આભાર માનું છું. આપના જુના વખતના સતપંથ ને માનતા આવ્યા હશો,
તે તદ્દન ભુલ હતી. અસલ. આપનો જુનું ધર્મ તો સનાતન જ છે પણ
આપણે સતપંથને અવળે માર્ગે ચડી ગયા હતા કારણ કે વેદ ગાયત્રી
શું છે તે કોઈ પણ સમજતા નહોતા હિંદુ અને મુસલમાનનું ધર્મ એક જ
છે એમ માનતા હતા પણ હિંદુ અને મુસલમાન જુદા જુદા ધર્મ છે. તે
મથાળે એક જ હોય પણ ઈશ્વરને ગાવે જવાના અનેક માર્ગો છે. કોઈ
રામનો કોઈ ઈશ્વરનો કોઈ કૃષ્ણનો કે બીજા કોઈ દેવનું નામ જે લઈ
પણ શરણ એક જ ઈશ્વરના સ્વરૂપમાં જાય છે મનુષ્ય માત્ર પોતાના
ઈષ્ટ દેવને માને છે તેમ આપણે પણ આપણા હિંદુ ના દેવોને માનવા
જોઈએ પણ આપણા કેટલાક ભાઈઓ તે માનતા નથી માટે આપણે
સનાતનમાં જોડાએ હશે તો આપણે નહિ હિંદુ કે નહિ મુસલમાન
એમ અર્ધ દગાદા ધર્મ પાળે છે આપણા જ ભાઈઓ ગુજરાતમાં વસે
છે તેમ દેશાવર અથવા કચ્છ પણ જાય છે તો તેમને ધર્મના વિષયમાં પુછે
તો આપણને ખોટું બોલવું પડે છે ને આપણે કોને માનીએ છીએ તે
સત્ય કહી શકતા નથી આપણે હિંદુ છીએ આપણે હિંદુ તરીકે પરણાવવામાં
ચોકો બંધાવવા જોઈએ ને મુસલમાનો પડે છે તેમ આપણે
હિંદુ ધર્મના રીત રિવાજ માત્ર મુકી ગયા છીએ માટે ભાઈઓ હવે અગો
ભાઈઓ નો ત્યાગ કરો ને આપણા નહીં આપણા શાસ્ત્રોમાં એમ
લખ્યું છે કે ગાય બ્રાહ્મણને માનવું નહિ તો તે રીતે આપણે હિંદુ તરીકે
ના. ભુલવાળા ને માર્ગે ચડી ગયા હશો આપણા સનાતનમાં આપણી જ સનાતન
ના શ્રીમાન રતનશી ભાઈ તથા બીજા તેમના સાથે મળી જે આપણા
આ સનાતન જાગૃત કર્યું છે ને આ સનાતન ના સેવા કરે છે તે કોઈ દિન
પણ અમે ભુલાય તેમ નથી પરંતુ આપણા પરાયા ધર્મ માના નારા ભા-
ઈઓ આપણા આ સુધારક ભાઈઓને ઠોકાય વસ્તુ ગણના કરે છે
પણ તે અજ્ઞાન કેમ રોવાશે તે સત્ય શું છે તે સમજી શકતા નથી
ભાઈઓ આપણા શુભ આજ ભાઈઓ એ જેમ ખરૂ સનાતન ધર્મ
પકડ્યું તેમ આપણે સનાતન ધર્મનો પ્રચાર કરવો. તે પ્રમાણે -

https://archive.org/details/bk1049/page/n5/mode/1up
-Mathal Sanatani Sabha Minutes (1049)

realpatidar.com

વરતવું ડહાપણ ભરેલું ગણાય જે ધર્મ વાડા વરતન કરે ન
આપણા સ્વાર્થ ખાતર કરે તેવા ખોટા વ્યસનો વાળાને ઉથલાવી
નાખવા માટે ભાઈઓ હવે આપણે જ્ઞાતિમાં જેમ બને તેમ
જલ્દી સુધારો કરી મહેરો બાંધવા ને જલ્દી શુદ્ધ સનાતનધર્મ-
પાળતા થઈએ એવી મારી ભાવના છે

ભાઈશ્રી રતનશી ખીમજી નું ભાષણ.

શ્રીમાન પ્રમુખ સાહેબ તથા પુજ્ય જ્ઞાતિ બંધુઓ તથા માતા
તથા બહેનો આપણી સભા ઈશ્વર કૃપાએ બહું સારી ગણાય
આપણી જ્ઞાતિ જ્યાં સુધી આ ધર્મ પર દ્રઢતા નહીં લાવે ત્યાં
સુધી હું વારંવાર દર ના લેખીતવાલા ટીકા કરીશ. આ જ્ઞાતિ નિશ્ચળ
કરવું જ્યાં સુધી મારા ભાઈઓ આ ખુલાસા માટે બહાર નીકળ
હું અભિમાન નથી કરતો પણ શરીર ભાઈ એ મન આ પોતાના
પધરામણા આપણે બહાર આવવું જોઈએ આ મારૂં શરીર તન
ને અર્પણ કરવું છે તેમ મારા સર્વ મીત્રો આજ સુધારક જ્ઞાતિ
ભાઈઓ નથી આ જ્ઞાતિને માટે અમારી આત્મા ની જરૂર
હશે તો અમારૂં આત્મા પાછા નહિ પડીએ કે ભલો મરી
જવા પણ ધર્મ ને માટે મરી ફીટવું એમ ઈચ્છું છે મારી ભાવ
પ્રતીજ્ઞા છે મારૂં માથું આ જ્ઞાતિ ના ચરણમાં છે મારૂં બલીદાન
થાય પણ મારૂં કાર્ય ફલીભુત થાય એમ ઈચ્છું છું ને આ
આ જ્ઞાતિ પાસે ભીખ માગી કહુંછું કે આપ જ્ઞાતિ ભાઈઓ
શુભમાર્ગે આવો વિશેષમાં બહુજ ગણું લાબું અને ગણાઈ તૈયાર
ઘણાજ બહુ આગ્રહ હતા ને માટે તેમજ રહસ એમજ રહો જે
જ્ઞાતિ સુમાર્ગે આવે (તાળીઓનાં ગડગડાટ)

કુરશન ભાઈ ખીમજી ગામ કોટડા વાળાનું ભાષણ

વ્હાલા જ્ઞાતી બંધુ ઓ તથા માતાઓ તથા બહેનો
આપણી જ્ઞાતિ ના અજ્ઞાનતા થી આપણે ધર્મ બાબતમાં અંધારામાં
છીએ ને આપણી જ્ઞાતિમાં વિદ્યાનો અભ્યાસ ઓછો છે આ પીરાણા
પીરાણા પંથમાં ફસાયા ગયા છીએ માટે મ્હારા વ્હાલા યુવક
ભાઈઓ ને સમજવું જોઈએ કે ગામોગામ યુવક મંડળ સ્થાપન
કરવા જોઈએ ને તેમાં શરીર ધર્મ તથા જ્ઞાતિના ઉન્નતિ ના માર્ગો
કાઢી શોધી લેવા જોઈએ વધારે વખતે (તાળીઓ)

realpatidar.com

https://archive.org/details/bk1049/page/n6/mode/1up
-Mathal Sanatani Sabha Minutes (1049)

realpatidar.com

પચાણ ભાઈ રામજી ગામ કોટડા વાળા નું ભાષણ

પ્રિય શાન્તા બહેનો તથા પુજ્ય માતા તથા બહેનો અને આપણા સમાજના સેક્રેટરી ભાઈ એ મને બોલવાને માટે ફરજીયાત મુકેલ છે જેથી બે બોલ બોલું છું તેમાં ભુલ હોય તો ક્ષમા કરશો આપણા શાન્તા ભુલ ને માર્ગે ચઢી ગયા હતા તે હું સમયમાં પાછા સત્ય નો માર્ગ સોધ્યા કરી છે જેથી હું ઘણો આનંદ પામ્યો છું અને આશા રાખુ છું શાન્તાને જલ્દી પાછા મનુ સુમાર્ગે લાવે એમ ઈચ્છુ છું વિગેરે વિગેરે (તાળીયો)

તેજા સવજી ગામ મથલ વાળાનું ભાષણ

પ્રિય શાન્તા બહેનો તથા માતાઓ તથા બહેનો ઈશ્વર નીરાકાર છે તેને સાકારમાં લાવવા માટે જ મુરતી પુજન છે મુરતી પુજન નું મુખ કારણ એજ છે કે આ આપણું ધ્યાન લાગે ને પછી આપણે જલ્દી સુધારવું જોઈએ તે ઉપર ભાષણ આપ્યું (તાળીયો)

નથુભાઈ ભીમજી ગામ નખત્રાણા વાળા નું ભાષણ

દરેક શાન્તા બહેનો તથા માતાઓ તથા બહેનો આજના મેળામાં વાલેશ્વર ભાઈઓ એ બહુ મહેનત થી બહુ દુર ગામથી પધારી આજના સંમેલન ને માન આપ્યું છે તે ભાઈઓ નો હું આભાર માનું છું ~~અને~~ હું વિદ્વાન નથી જે આપને ધર્મ સંબંધી કાંઈ સમજાવી શકું પણ મારા કરતા વિદ્વાન ભાઈઓએ આપને ઘણું સારૂ અને આપને બંધ બેસતુ સમજાવ્યું છે જે સાંભળી ખરેખર આપણા હીતનું હોય તે સ્વીકારી લેશો. આપણે પરદેશ જવાથી આપણા શાન્તામાં પડેલ ભુલ જોઈ શક્યા છીએ અને આપણા શાન્તાઓમાં જે કુ પડેલ ભુલનું ભાન જ્યારથી થયું છે ત્યાંથી મારાથી બનતા યત્નો કરતો રહ્યો છું આજના સંમેલનમાં જે કીર્તની તથા શાન્તાના ભાઈઓને જે ઉત્કંઠાઓ આ શાન્તાને સુમાર્ગે લાવવા દરેક ભાઈઓ પોતાના થી બનતું જે કરી રહ્યા છે તે જોઈને ઘણો ખુશી થયો છું ને ઈશ્વર પાસે એટલું માગું છું જે મારી આ શાન્તા ને સુમાર્ગે જલ્દી લાવે વાલેશ્વરમાં આપણી શાન્તા નો ઉદય એટલે વસ્તુથી થવાનો છે જે માત્ર ગામો ગામ ઈસ્કુલો ખુલવી જોઈએ ને તેમાં સારા મુદરસો ને રોકી ને બાળકોને કેળવણી ને ધાર્મિક શિક્ષણ આપવું ને આપણા સમાજના સુધારણ ઉપયોગ ખુલવા ને વિશેષમાં પુજ્ય મહારાજ શ્રી ઓધવરામ મહારાજ નો સુખ સંદેશો વાંચી સંભળાવ્યો હતો વિગેરે વિગેરે

(તાળીયો)

https://archive.org/details/bk1049/page/n7/mode/1up
-Mathal Sanatani Sabha Minutes (1049)

KJ-BK-3-34

realpatidar.com

ભાઈજી નાગજી મથલ વાળાનું ભાષણ

પ્રમુખ સાહેબ પુજ્ય વડીલો પુજ્ય સ્વામીજી કહ્યું કે માતાઓ બહેનો તેમ ધારે તો અગર ધર્મ રાખે તો માટે ઓલાદ વારે પોતાના પ્રાણનો બલીદાન દીધા છે તેના ઉપર વાર બહાદુર રાય નું દ્રષ્ટાંત સત્યપાલ કહ્યું આગળ તો માત્ર સંકટ સહન કર્યું છે ને બહુજ આપણું સત્ય ધર્મનો નાશ થયો છે શાસ્ત્રો કહે છે સ્વધર્મે નીધનો શ્રેય પરધર્મો ભયાવહ ભાઈઓ સ્વધર્મને માટે મનુ ભાઈ તોપણ સારું છે ને પરકો ધર્મ ભય ઉપજાવે તેવો છે એટલે અહીંયા ગામ ફરનાર ફુલોવાળો આપણા ઉપર અહીંયા ગામ ધણી છે કે જુઓ હરા રણ ગંગાજળ બેસી જગાવેદની સાથે મુકી ને આપે ગામ થી દરવાજા શુદ્ધ રાખત બીજ મસાણમાં ભાઈ બૂડે તેમ આપણે ભાઈ બુદ્ધિ છાએ માટે ભાઈ હવે જાગૃત થાવ જાગૃત થઈ ને ચાલો મહારા આગળ વડો

ચાલો મ કરી આગળ વધો, એ કુમ વાડી ગાય છે,
આગે પહોંચે આગે, એ સત્ય ભાગી થાય છે,
કુતરા પણ આગળ આવે, તેને ભેદી જાય છે,
સત્ય કર્મનો પ્રચાર. નિરંજન સહાય છે,
(તાળીયો)

કેશવજી ભાઈ વાલજીભાઈ નું ભાષણ

પુજ્ય સ્વામીજી કહ્યું કે પધારેલા સદગ્રહસ્થો આપને હું આમ વંદન કરૂં છું ને બે બોલ બોલું છું અમારા ગામ ના સંરક્ષણ બોલ ને તેમાં પહેલા ગામનો ત્યાગ કર્યો ને પણ ધારણોને કુડી નામો કુલ ને પણ સત્ય ત્યાગ ઉભા કરીએ તેનું મુખ્ય કારણ કે સમજુ છું તો ના કારણ કે સત્ય ત્યાગ ઉભા કરી ગઈ માટે પહેલું પોતાનું મન દુઃખ ગર દુઃખ સાનમાં જાગૃત કરવા એટલું બોલ બેસી જવા રજા માગુ છું
(તાળીયો)

realpatidar.com